



રાજકોટ રાજપથ લી.

(કંપનીઝ એક્ટ હેઠળ સંસ્થાપિત રાજકોટ મહાનગરપાલિકા ની સંપૂર્ણ આનુષંગિક કંપની)

Corporate Identification Number : U93000GJ2012PLC072203

૩જો માળ, મલ્ટી એક્ટીવીટી સેન્ટર, નાનામવા ચોક, ૧૫૦' રીંગ રોડ,

Connecting people with buses...



-: અખબારી યાદી:-

“શહેરી પરિવહન સેવાની કામગીરીનો માર્ચ – ૨૦૨૧ માસનો રીપોર્ટ”

તારીખ: ૧૬-૦૪-૨૦૨૧

૧. સિટી બસ (RMTS) સેવા

• જનરલ-

- કોવિડ-૧૯ અંતર્ગત ૭૫% મુજબ (૩૭ રૂટ પર ૭૪ સિટી બસ) દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.
- સિટી બસ સેવા (RMTS)માં માર્ચ મહિના દરમિયાન કુલ ૪,૪૪,૬૬૮ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૬,૮૮,૪૬૧ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.
- ગત તા.૩૧/૦૩/૨૦૨૧ ના રોજ શિફ્ટ પરના ટ્રાફિક ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા સિટી બસ સેવામાં કાર્યરત ડ્રાઇવરો ને રૈયા ચોકડી ડેપો તથા આજી ડેપો ખાતે ડ્રાઇવિંગ કરતી વખતે તકેદારી રાખવા, ડ્રાઇવરો દ્વારા ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે, સર્કલ પરના ટર્નિંગ, સીટ બેલ્ટ પહેરવા વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ.

• સિટી બસમાં થયેલ કામગીરી:-

- સિટી બસના બસ સ્ટોપ તથા પીક અપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતુ તેના પર ટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે.

• સિટી બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ:-

- સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ ૧૩,૩૫૦ કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ રૂ. ૫,૪૩,૨૫૬/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.
- સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી શ્રી ડી.જી. નાકરાણીને કામમાં ક્ષતિ બદલ કુલ રૂ. ૨૩,૭૦૦/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.
- સિટી બસ સેવામાં સિક્યુરીટી એજન્સી નેશનલ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ. ૨,૭૦૦/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.
- સિટી બસ સેવાની કામ ગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ ૬(છ) કંડક્ટરને કાયમી ધોરણે ફરજ મુક્ત કરેલ છે તથા ૧૬(સોળ) કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
- ચેકીંગ દરમિયાન કુલ ૫ (પાંચ) મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ રકમ રૂ. ૫ ૫૦/- નો દંડ વસૂલ કરવામાં આવેલ છે.

૨. બી.આર.ટી.એસ. બસ સેવા

• જનરલ-

- કોવિડ-૧૯ અંતર્ગત BRTS રૂટ પર કુલ ૧૦ BRTS બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.
- બી.આર.ટી.એસ. બસ સેવામાં માર્ચ મહિના દરમિયાન કુલ ૭૩,૧૮૧ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૪,૧૮,૧૦૬ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.
- ગત તા.૩૧/૦૩/૨૦૨૧ ના રોજ શિફ્ટ પરના ટ્રાફિક ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા બી.આર.ટી.એસ. બસ સેવામાં કાર્યરત ડ્રાઇવરોને ગોડલ ચોકડી ડેપો ખાતે ડ્રાઇવિંગ કરતી વખતે તકેદારી રાખવા, ડ્રાઇવરો દ્વારા ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે, સર્કલ પરના ટર્નિંગ, સીટ બેલ્ટ પહેરવા વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ.

• બી.આર.ટી.એસ. બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ :-

- બી.આર.ટી.એસ. બસ સેવામાં બસ ઓપરેટર શ્રી માતેશ્વરી ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ ૯૨૦ કિ.મી. ની પેનલ્ટી તરીકે કુલ રૂ! ૬૨,૯૪૬/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.
- બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!. ૨૩,૦૫૪/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.
- ચેકીંગ દરમિયાન કુલ ૪ (ચાર) મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ રકમ રૂ! ૪૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

સિટી બસ સેવામાં ટીકીટ વગર મુસાફરી કરવી એ દંડને પાત્ર બને છે. તેમજ સિટી બસ (RMTS) અને BRTS બસ સેવામાં મુસાફરી કરતાં પેસેન્જર દ્વારા મુસાફરી દરમિયાન પોતાની ટીકીટ મેળવી લેવાની જવાબદારી થાય છે. કોઇપણ નાગરિક દ્વારા સિટી બસ સ્ટોપ , પીક અપ સ્ટોપ વિગેરે જેવી રાજકોટ મહાનગરપાલિકાની જાહેર મિલકત હોય , તેના પર પોતાની અંગત (ધંધા/દુકાન/સંસ્થા)ની જાહેરાત લગાવવી તે દંડનિય તથા કાયદેસરનાં પગલા લેવાને લાયક છે. સદરહું બાબતે પરિવહન સેવામાં સુપરવાઇઝરી સ્ટાફ મારફતે કાર્યવાહી કરાવવામાં આવેલ છે.

વધુમાં કંડક્ટર દ્વારા નિયત દરની ટીકીટ ન આપે કે તેની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા જણાયે રાજકોટ મહાનગરપાલિકાના ૨૪*૭ ધોરણે કાર્યરત કોલ સેન્ટર નંબર ૦૨૮૧-૨૪૫૦૦૭૭ પર ફરીયાદ નોંધાવી શકાય છે.

Sd/-

ડે. જનરલ મેનેજર

રાજકોટ રાજપથ લી.